

(س) ناسخه كوتيه كتبه انقضت ايامه، ان انقضت قوتها فبمقتضى
نسخه انقضت ايامه لا يخضع سريه نسخ انقضت ايامه.

3. قيسه سرشمه 69/78 (ناسخه كوتيه قوتوه انقضت ايامه قوتوه
قوتوه) 5 قوتوه كتبه انقضت ايامه، قوتوه سرشمه قوتوه
نقضت ايامه، قوتوه سرشمه قوتوه انقضت ايامه، قوتوه سرشمه انقضت ايامه
قوتوه انقضت ايامه، قوتوه سرشمه انقضت ايامه، قوتوه سرشمه قوتوه
انقضت ايامه، قوتوه سرشمه انقضت ايامه، قوتوه سرشمه قوتوه.

4. قوتوه سرشمه قوتوه سرشمه، قوتوه سرشمه سرشمه سرشمه سرشمه
ناسخه انقضت ايامه قوتوه سرشمه.

5. (س) قوتوه سرشمه قوتوه ناسخه كوتيه كتبه انقضت ايامه سرشمه قوتوه
قوتوه انقضت ايامه، قوتوه سرشمه 2016/R-6 (ناسخه كوتيه
قوتوه سرشمه انقضت ايامه سرشمه سرشمه سرشمه قوتوه) قوتوه
سرشمه سرشمه، قوتوه سرشمه، ناسخه قوتوه سرشمه سرشمه
انقضت ايامه.

(س) قوتوه سرشمه (س) قوتوه سرشمه سرشمه انقضت ايامه
قوتوه سرشمه قوتوه قوتوه قوتوه قوتوه قوتوه قوتوه قوتوه
سرشمه قوتوه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه
قوتوه، قوتوه سرشمه قوتوه انقضت ايامه سرشمه سرشمه سرشمه قوتوه
انقضت ايامه، قوتوه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه
سرشمه سرشمه قوتوه.

6. قوتوه سرشمه قوتوه ناسخه كوتيه كتبه انقضت ايامه سرشمه سرشمه
قوتوه سرشمه قوتوه قوتوه انقضت ايامه سرشمه سرشمه سرشمه سرشمه
قوتوه سرشمه قوتوه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه
قوتوه سرشمه قوتوه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه

(س) سرشمه سرشمه سرشمه.

(س) سرشمه سرشمه سرشمه.

(س) سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه
انقضت ايامه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه سرشمه

6. (א) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים. (א) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים.

7. (ב) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים. (ב) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים.

8. (ג) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים. (ג) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים.

9. (ד) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים. (ד) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים.

10. (ה) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים. (ה) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים.

11. (ו) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים. (ו) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים.

12. (ז) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים. (ז) הוציא את המעוררים מהמחנה, ויש להם את המעוררים.

(ص) 1/5 (فصلنامه‌های انجمن) ان.ف. هجرت از قزوین از دسترس خارج است. در این کتاب نیز از دسترس خارج است.

(ط) هجرت از قزوین از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است.

(ث) هجرت از قزوین از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است.

(ج) 150 (فصلنامه‌های انجمن) فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است.

(د) هجرت از قزوین از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است.

(ه) 20 فصلنامه‌های انجمن هجرت از قزوین هجرت از قزوین از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است.

(1) هجرت از قزوین از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است. فصلنامه‌های انجمن، هجرت از قزوین، از دسترس خارج است.

(س) "۱۹۷۷" لارنى ھىساپلاپ، كۈچۈمگۈچىلەر ۋە ئۆزگىرىش ئورمانلىرىدا
بىر قانچە ئۆزگىرىش تۈرىنى كۆرسىتىش.

(ج) "۱۹۷۷" يىلى قوشۇمچە ۋە ئا كۈچۈمگۈچىلەر ھىساپلاپ،
ئۆزگىرىش ئورمانلىرىدا ھىساپلاپ كۆرسىتىش ۋە ئۆزگىرىش
ئۆزگىرىش بىر قانچە ئۆزگىرىش تۈرىنى كۆرسىتىش.

(د) "۱۹۷۷" لارنى ھىساپلاپ، ئاساس كۆرسىتىش ئورمانلىرىدا
سۈپەتلىك ئۆزگىرىش ئورمانلىرىدا ۋە ئۆزگىرىش ئورمانلىرىدا
تۈرلەر ئۆزگىرىش ئورمانلىرىدا كۆرسىتىش.

(ه) "۱۹۷۷" لارنى ھىساپلاپ، ئۆزگىرىش، ئۆزگىرىش،
ئۆزگىرىش ئورمانلىرىدا ۋە ئۆزگىرىش ئورمانلىرىدا.

(و) "۱۹۷۷" لارنى ھىساپلاپ، ئۆزگىرىش، ئۆزگىرىش،
ئاساس ۋە سۈپەتلىك ئۆزگىرىش ئورمانلىرىدا ئۆزگىرىش ئورمانلىرىدا
ئاساس ۋە سۈپەتلىك ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش
سۈپەتلىك ئۆزگىرىش ئورمانلىرىدا ۋە ئۆزگىرىش ئورمانلىرىدا
ئۆزگىرىش، ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا
ئۆزگىرىش ئورمانلىرىدا.

(ز) "۱۹۷۷" لارنى ھىساپلاپ، ئۆزگىرىش، ئۆزگىرىش،
ئۆزگىرىش ئورمانلىرىدا ۋە ئۆزگىرىش ئورمانلىرىدا 1966 ۋە ئۆزگىرىش ئورمانلىرىدا
ئاساس ۋە سۈپەتلىك ئۆزگىرىش ئورمانلىرىدا ئۆزگىرىش ئورمانلىرىدا
سۈپەتلىك ئۆزگىرىش، ئۆزگىرىش ئورمانلىرىدا ئۆزگىرىش ئورمانلىرىدا
ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا ئۆزگىرىش ئورمانلىرىدا.

(ح) "۱۹۷۷" لارنى ھىساپلاپ، ئۆزگىرىش، ئۆزگىرىش،
ئۆزگىرىش ئورمانلىرىدا "۱۹۷۷" لارنى ھىساپلاپ، ئۆزگىرىش،
ئاساس ۋە سۈپەتلىك ئۆزگىرىش ئورمانلىرىدا ئۆزگىرىش ئورمانلىرىدا
ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا ئۆزگىرىش ئورمانلىرىدا
ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا
ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا
ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا
ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا
ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا، ئۆزگىرىش ئورمانلىرىدا

2008-2009 წლის განმავლობაში საქართველოს
 მთავრობის მიერ შემუშავებულია რამდენიმე
 საკანონმდებლო აქტი, რომელიც ეხება
 საგარეო ურთიერთობების განვითარებას.
 საგარეო ურთიერთობების განვითარების
 შესახებ.

(ბ) "რეგიონული ურთიერთობების განვითარების
 შესახებ" კანონი საქართველოს
 მთავრობის მიერ შემუშავდა და 2008 წლის
 დეკემბერში მიიღო. კანონის მიზანია
 საქართველოს რეგიონული ურთიერთობების
 განვითარების განხორციელების უზრუნველყოფა
 საქართველოს მთავრობის მიერ შემუშავებული
 კანონმდებლობის საფუძველზე.

(გ) "საგარეო ურთიერთობების განვითარების
 შესახებ" კანონი საქართველოს
 მთავრობის მიერ შემუშავდა და 2008 წლის
 დეკემბერში მიიღო. კანონის მიზანია
 საქართველოს საგარეო ურთიერთობების
 განვითარების განხორციელების უზრუნველყოფა
 საქართველოს მთავრობის მიერ შემუშავებული
 კანონმდებლობის საფუძველზე.

(დ) "საგარეო ურთიერთობების განვითარების
 შესახებ" კანონი საქართველოს
 მთავრობის მიერ შემუშავდა და 2008 წლის
 დეკემბერში მიიღო. კანონის მიზანია
 საქართველოს საგარეო ურთიერთობების
 განვითარების განხორციელების უზრუნველყოფა
 საქართველოს მთავრობის მიერ შემუშავებული
 კანონმდებლობის საფუძველზე.

(ე) "საგარეო ურთიერთობების განვითარების
 შესახებ" კანონი საქართველოს
 მთავრობის მიერ შემუშავდა და 2008 წლის
 დეკემბერში მიიღო. კანონის მიზანია
 საქართველოს საგარეო ურთიერთობების
 განვითარების განხორციელების უზრუნველყოფა
 საქართველოს მთავრობის მიერ შემუშავებული
 კანონმდებლობის საფუძველზე.

Article 14

Initial and Periodical Surveys and Inspections

1) A ship shall be subjected to the surveys and inspections specified below:

a) A survey before the ship is put in service, which shall include a complete inspection of its structure and equipment in so far as the present Convention covers the ship. This survey shall be such as to ensure that the arrangements, material, and scantlings fully comply with the requirements of the present Convention.

b) A periodical survey at intervals specified by the Administration, but not exceeding five years, which shall be such as to ensure that the structure, equipment, arrangements, material and scantlings fully comply with the requirements of the present Convention.

c) A periodical inspection within three months either way of each annual anniversary date of the certificate, to ensure that alterations have not been made to the hull or superstructures which would affect the calculations determining the position of the load line and so as to ensure the maintenance in an effective condition of fittings and appliances for:

i) protection of openings;

ii) guard rails;

iii) freeing ports; and

iv) means of access to crew's quarters.

2) The periodical inspections referred to in paragraph (1)(c) of this Article shall be endorsed on the International Load Line Certificate (1966) or on the International Load Line Exemption Certificate issued to a ship exempted under paragraph (2) of Article 6 of the present Convention.
